

National Stock Exchange of India Ltd. "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai – 400 051. Scrip Symbol : APARINDS <u>Kind Attn.: The Manager, Listing Dept.</u>	BSE Ltd. Corporate Relationship Department, 27 th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001. Scrip Code : 532259 <u>Kind Attn. : Corporate Relationship Dept.</u>
---	--

Sub: Submission of publication of advertisement regarding 32nd Annual General Meeting in the newspapers (Pre-despatch)

Ref: Intimation under Regulation 30 and all other applicable regulations, if any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, please find enclosed herewith the copies of newspaper advertisement published in Business Standard, (English language newspaper having Nationwide Circulation) and Vadodara Samachar, (Gujarati language newspaper) at Vadodara, in compliance with Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 5, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021, intimating that 32nd Annual General Meeting (AGM) of the Company will be held on Friday, August 13, 2021 at 2.30 pm (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

This is for your information and record.

Thanking you,

Yours faithfully,

For APAR Industries Limited

HARISHKUMAR

SHAMJI

MALSATTER

(Harishkumar Malsatter)

Assistant Manager – Secretarial & Legal

Encl. : As above

APAR Industries Limited

Corporate Office : APAR House, Corporate Park, V. N. Purav Marg, Chembur, Mumbai - 400 071, India
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com

Regd. Office : 301/306, Panorama Complex, R. C. Dutt Road, Alkapuri, Vadodara - 390007, India
+91 265 6178 700/6178 709 apar.baroda@apar.com www.apar.com CIN : L91110GJ1989PLC012802

E-AUCTION SALE NOTICE

NOTICE is hereby given to the public in general under the Insolvency and Bankruptcy Code, 2016 and Regulations there under that the assets of M/s Eagle Cotton Private Limited - In Liquidation (Corporate Debtor) situated at Plot No. 1,2,3, Revenue Survey No. 90/Paiki, Laxminagar Industrial Estate C, Near Narayan Spinning, Amreli Kukavav Road, Mangyapal, Amreli will be sold by E-auction through the service provider M/s C1 India Private Limited via website <https://www.banksauctions.com>

Date and Time of Auction	Monday, 19.07.2021 Option 1 Between 11:00 AM to 1:00 PM 17.07.2021 before 02:00 PM
Last Date for Submission of EMD	On 16.07.2021 From 11:00 AM to 5:00 PM
Inspection Date & Time	Contact person +91-87803-79134

Bid Option	Details of assets	Block (Rs.)	Reserve Price (Rs.)	Earnest Money Deposit (Rs.)
1	Sale on parcels basis of Land & Building*	Block 1	19,132,200	19,13,220

- The Assets of the Company are proposed to be sold on "As is where is basis", "As is what is basis", "Whatever there is basis" and "No recourse" basis
- Interested bidders can submit the Expression of Interest, Confidentiality and Non-disclosure undertaking on or before 16.07.2021 (mandatory for inspection available in process document)
- The EMD together with Bid Forms shall be payable by interested bidder through NEFT/ RTGS/ Demand Draft on or before 17.07.2021 in account mentioned below

Details of bank account are as follows: Account Number : 310020110001145, Beneficiary Name : Eagle Cotton Private Limited - In Liquidation, Bank Name : Bank of India, Branch : Rajkot Main Branch, IFSC Code : BKID0003100.

For detailed terms and condition of Sale and E-auction, refer E-auction Process Information Document available at <https://www.banksauctions.com>. For any query regarding sale contact Mr. Rajeev Tripathi at +91-8780379134 & E-mail ID: ipradeep.eagle@gmail.com and for E-auction contact Mr. Bhavik Pandya at +91-866662937 & E-mail ID: gujarat.c1india.com Sd/- Pradeep Kumar Kabra Liquidator of Eagle Cotton Private Limited
 IBI Reg. No: IBBIPA-001/PI-101/2017-18/11790

Bank of Baroda
 Pitha Branch : At P.O. Pitha, Kanbiwad, Tal. G Dist. Valsad-396045. (Gujarat)
 Phone : 02632-273466 • Email : pitha@bankofbaroda.com

POSSESSION NOTICE (Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of the Bank of Baroda, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of Powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) rules, 2002, issued demand notice dated 06.04.2021 calling upon the Borrowers Mr. Bhalchandra Dagdu Patil (Borrower), Mr. Parash Bhalchandra Patil (Co-Borrower) and Nilesh Bhalchandra Patil (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs. 9,33,773.61 (Rs. Nine Lacs Thirty Three Thousand Seven Hundred Seventy Three & Sixty one Paisa Only) and interest thereon w.e.f.05/04/2021 within 60 days from the date of receipt of the said notice.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this 8th day of July of the year 2021.

The Borrowers' Attention is invited to Provision of Sub-Section (8) Of Section 13 Of The Act, In Respect of Time Available, To Redeem The Secured Assets
 The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, Pitha Branch, Valsad for an amount of Rs. 9,33,773.61 (Rs. Nine Lacs Thirty Three Thousand Seven Hundred Seventy Three & Sixty one Paisa Only) as on 05.04.2021 inclusive of interest up to 05.04.2021 and further interest & expenses thereon until the full payment.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES

All the piece and parcel of immovable property NA Block 143 Paikae Along with constructed old Gala Type Chawl Out of that, Eastern Gala No. 6 bearing Gram Panachayat House No. 2/176 of 7 Gala Chawl, Admeasuring 28 Fts in length and 10 Fts in Width Along with Open Space of 10 Fts, Infront of House and 6 Fts, B/h. the House total Built up area 280 sq. ft, Total Admeasuring 31.57 sq. mtrs of situated at Village Parnera, Valsad, Taluka & Dist. Valsad belongs to Mr. Bhalchandra Dagdu Patil

Bounded by: • East : Gala No. 5 • West : Gala No. 7
 • North: Open Land
 • South: 10 fts Wide Road for the use of 7 Gala Owners

Date : 08.07.2021 (K. Rama Krishna)
 Place : Valsad Authorised Officer, Bank of Baroda

APAR APAR INDUSTRIES LIMITED
 (CIN : L91110GJ1989PLC012802)
 Regd. Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
 Phone : (0265) 2339906 Fax : (0265) 2330309 Res: Plot NO I-13, Yogi Kripa Society, Shree Sherdi Nagar, B/H Roosevelt Public School, Warasiya Ring Road, Vadodara- 390006

INFORMATION REGARDING 32nd ANNUAL GENERAL MEETING OF APAR INDUSTRIES LIMITED

1. The Thirty-Second Annual General Meeting (AGM) of APAR Industries Limited (the "Company") will be held through Video Conferencing (VC)/ Other Audio-Visual Means (OAVM) on Friday, August 13, 2021 at 02:30 P.M. (IST), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the relevant Rules made there under and the Securities and Exchange Board of India (SEBI)(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), as amended from time to time, read with General Circular Nos. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020 and 02/2021 dated 13.01.2021 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars"), to transact the business set out in the Notice calling the 32nd AGM.

Members will be able to attend the 32nd AGM through VC / OAVM mode only. The detailed instructions with respect to such participation will be provided in the Notice convening the AGM. Members participating through the VC / OAVM mode shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

2. In compliance with the aforesaid Circulars, Notice of the 32nd AGM along with the Annual Report for the Financial Year 2020-21, will be sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company / Depositors. Members may note that the said Notice and Annual Report will also be available on the Company's website www.apar.com, websites of the Stock Exchanges i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Central Depository Services (India) Limited (CDSL), an agency appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC, www.evotingindia.com.

3. Manner of registering / updating (1). Email addresses in order to facilitate the Company to serve the documents through the electronic mode and (2). Bank Accounts details for receiving dividends directly in bank accounts:

- Members holding shares in physical mode, who have not registered / updated their email addresses / Bank Account details with the Company, are requested to register / update the same with the Company by sending an Email at investor.services@apar.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN, Aadhaar Card and cancelled cheque leaf.
- Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants, are requested to register / update the same with the Depository Participants with whom they maintain their demat accounts.
- Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Accounts Details on the link given below : https://www.linkintime.com/EmailReg/Email_Register.html

4. Manner of casting vote(s) through e-voting:

- Members will have an opportunity to cast their votes on the business as set out in the Notice of the 32nd AGM through electronic voting system (e-voting).
 - The manner of voting remotely (remote e-voting) by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM. The details will also be available on the website of the Company, BSE, NSE and CDSL.
 - The facility of e-voting through electronic voting system will also be made available at the AGM. Only those shareholders, who are present in the AGM through VC / OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM.
5. Members are requested to carefully read all the Notes set out in the Notice of the 32nd AGM dtd. May 31, 2021 and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the process of AGM.

By Order of the Board
 For APAR Industries Limited
 Sanjaya Kunder
 Company Secretary
 Place : Mumbai
 Date : July 09, 2021



Stressed Assets Targeted Resolution Action (SASTRA),
 CIRCLE - VADODARA, VADODARA STOCK EXCHANGE BUILDING,
 G-FLOOR, FORTUNE TOWER, VADODRA, Gujarat.

PUBLIC E-AUCTION NOTICE FOR SALE OF MOVABLE / IMMOVABLE PROPERTIES ON 12.08.2021

E-Auction Sale Notice for Sale of Secured Assets under the Securitization & Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) and Mortgagee (s) that the below described immovable/movable property mortgaged/charged to the Secured Creditor Banks namely Punjab National Bank, erstwhile United Bank of India and erstwhile Oriental Bank of Commerce and the physical/Symbolic possession of which has been taken by the Authorised Officer of the respective secured creditor Banks, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 12.08.2021, for recovery of its dues due to these above named secured creditor banks from the respective borrower (s), mortgagee (s) and guarantor (s). The Reserve price and the earnest money deposit is mentioned in the table below against the respective properties

Date of E-Auction -12-08-2021, LAST DATE OF SUBMISSION OF EMD AND BID DOCUMENTS : 11-08-2021 up to 4.00 PM
Date & Time of Inspection : From 12-07-2021 till 10-08-2021 (Between 11 pm to 4 pm)

SCHEDULE OF THE SECURED ASSETS

Lot No.	Name of Branch	Name of Account	Detail of Immovable Properties Mortgaged/ Owner's Name (Mortgagors of propert(ies))	A) Dt. Of Demand Notice u/s 13(2) of SARFESI ACT 2002		A) Reserve Price (Rs. In Lacs)		Date/Time of E-Auction
				B) Outstanding Amount as on 30.06.2021	C) Possession Date u/s 13(4) of SARFESI ACT 2002	B) EMD (Rs. In Lacs) Amt & Last date of Deposit	C) Bid Increase Amount (Rs. In Lacs)	
1.	PNB-ATMAJYOTI ASHRAM (340800)	ARVINDBHAI RAMDAS THAKUR	Registration District Vadodara, Sub District Vadodara, Vibhag -1, Village Vadodara Kasba, (Sayajigunj) area, R.S No -445/1 paiki, T.P. Scheme No-66, F.No-13 paiki (old F.P. No-17/2 paiki) total admeasuring about 9378.00 Sq. mtrs. paiki 5223.42 Sq. mtrs, land paiki Tower-C-1, 4th Floor Flat No-407 having built-up construction area 34.39 Sq. mtrs. With proportionate share of common space area 10.00 Sq. mtrs. In NATRAJ TOWNSHIP, Parshuram Nagar, Sayajigunj, Vadodara 390005. Property Owned By Mr. Arvindbhai Ramdas Thakur	A) 19-04-2018 B) Rs. 4,84,255.25 + Future Interest & Expenses thereon C) 14-06-2021 D) Symbolic	A) Rs. 7.70 B) Rs. 0.78 (11-08-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
2.	PNB-ANKLESHWAR (390100)	JAIN VATSALYA MAYUR	All that piece and parcel of immovable property of Flat No. B-405, Surya Palace Co-Op. Housing Society Ltd Admeasuring 66.00 Sq Mtrs, undivided share of land 28.23 Sq Mtrs, Plot No. H-3180, R.S. No. 282 at Village-Bhadokdra, Taluka- Ankleshwar Dist.- Bharuch belongs to Mr. Vatsalya Mayur Jain, Mrs. Priyanka Vatsalya Jain and having boundaries:- On the East : Compound Wall, On the West : Open Space & Common Passage, On the North : Compound Wall, On the South : Flat No. 406	A) 07-02-2021 B) Rs. 22,42,356.57/- as on 30.06.2021 + Future Interest & Expenses thereon WEF 01.07.2021 C) 02.07.2021 D) Physical	A) Rs. 17.16 B) Rs1.72 (11-Aug-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
3.	PNB-ANAND (100800)	Mr. Kalpeshkumar Saburbhai Panchal (Borrower)	Revenue Survey No.1283 Paiki 0-24-28 paiki, Sub Plot No.24 Adm.59-94 Sq Mtrs. NA Land+ Construction of G.F.48-79 Sq Mtrs. and F.F. Adm. 48-79 Total Construction 97-58 Sq Mtrs. City Survey No. 367/B/23 of Mogari Ta & Dist-Anand Gujarat" in the name of Kalpeshkumar Saburbhai Panchal	A) 15.02.2021 B) Rs. 17,81,976.99/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 25.06.2021 D) Symbolic	A) Rs. 17.06 B) Rs 1.71 (11-08-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
4.	PNB-BARODA (038320)	M/S MEHUL ENTERPRISE (Borrower)	Immovable Property being Block No.49 in "Jay Shri Ambika Niketan Society" B/h OLD RTO Warasiya, Vadodara land bearing Revenue Survey No.332 & 335, T.P. Scheme No. 5 Final Plot No. 26 & 88 of Mouje Savad in Registration District Baroda sub-District Vadodara. Property Owned By Mr. Jigar Dineshbhai Mistry, Property bounded as under: EAST: Plot No.48, WEST: T.P. Road., NORTH: Plot No.40, SOUTH: Road of Society	A) 27-04-2021 B) Rs. 27,84,367/- as on 30.06.2021 + Future Interest & Expenses thereon WEF 01.07.2021 C) 01-07-2021 D) Symbolic	A) Rs. 47.79 B) Rs. 4.78 (11-Aug-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
5.	PNB-OLD PADRA ROAD (145420)	MR. PATHAN MOHSINKHAN NASIRKHAN (BORROWER), MR. NASIRKHAN MAMRIKZHAN PATHAN (CO-BORROWER) Add: 6/41, Shiv Shakti Nagar(Kanta, Vadodara) Address (Guarantor) Mr. HASIT TRIVEDI (GUARANTOR) Add- B-52, Pramukhswni Nagar Society Behind Reliance Mart, Old Padra Road Vaodara, Gujrat- 390020	All that piece and parcel of Registration Dist. Baroda Sub-Dist. - Baroda for Land Bearing R.S. No. 389 paiki, TPS-22, FP No. 15, Area Adm. 4174 Sq. Mtrs, Paiki Western side Area Adm. 1045052 Sq. Mtrs. In Constructed the scheme in the name & style Mahi Complex on 2nd Floor, Flat No. 3 area adm. 1065.85 Sq. Mtrs., i.e. 1149.75 Sq. Ft., Undivided Land Area Adm. 66.78 Sq. Mtrs, Mouje- Tandajia. Property Owner Name:- Mr. Pathan Mohsinkhan Nasirkhan	A) 30.04.2021 B) Rs. 23,76,498.00/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 06.07.2021 D) Symbolic	A) Rs. 19.66 B) Rs 1.97 (11-08-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
6.	PNB-BHARUCH(113610)	Mr. Nasir Mahemudmiya Chisti (Borrower)	Equitable Mortgage the piece and parcel of land bearing Flat at Empire Heights, 5th Floor Flat no.503, Adm.65.70 Sq.Mtrs. and undivided share of land adm 30.00 Sq Mtrs. Of Plot no.3,4,5 Adm.332.37 Sq. Mtrs. Paiki revenue survey No.8 "Empire Heights" of mouje Nabipur, Taluka & Dist Bharuchin favour of Mr. Nasir Mahemudmiya Chisti and Tabassum Nasir Chishti	A) 02.02.2021 B) Rs. 5,88,450.79/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 02.07.2021 D) Symbolic	A) Rs. 10.56 B) Rs. 1.06 (11-08-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
7.	PNB-BARODA (038320)	YOGESHKUMAR NATVARLAL PATEL (Borrower)	All that Piece and Parcel Of Property located at registration District & Sub District Vadodara, (ZONE-5) Vadodara City, Vill Mouje- SAVAD, Land Bearing Revenue Survey No 384/1, Paiki City Survey No 57, Paiki South Side Land admeasuring 3365 Sq Mtrs, in constructed the scheme in the name and style of BILIPATRA COMPLEX, out of which 4th floor Flat no 404, Admeasuring 644 Sqfts Built up with complete construction. Property Owned By : YOGESHKUMAR NATVARLAL PATEL & HEMAXBEN YOGESHKUMAR PATEL Property Bounded as under: EAST: Flat No 402, WEST: Flat No 405, NORTH: Flat no 403, SOUTH: Margin	A) 27-04-2021 B) Rs. 16,02,318.69/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon WEF 01.07.2021 C) 01-07-2021 D) Symbolic	A) Rs. 16.10 B) Rs. 1.61 (11-Aug-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
8.	PNB-BARODA (038320)	M/S SHREE MEERA KRISHNA (Borrower)	Immovable residential house - Registration District Baroda sub-District Baroda land bearing R.S No 347,348, TPS No 5, FP No 114 in constructed the scheme in the name & style of yogi Krupa Society bearing block no L-13, Plot area ad. 64.14 SqMtr, bearing GF area adm 30.22SqMtr, FF area adm. 30.22 Sq Mtr Moje Savad Property owned by Mrs. Romaben Mukeshbhai Goklani	A) 15-04-2021 B) Rs. 13,14,974.07/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon WEF 17-04-2018 C) 01-07-2021 D) Symbolic	A) Rs. 32.32 B) Rs. 3.23 (11-Aug-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
9.	PNB-LAHRIPURA (014310)	WAGHELA NIKHILKUMAR	All Pieces of parcel of Raw house duplex No. 29 in having plot area admeasuring 40.01 sq. mtr and carpet area 59.90 sq.mtr undivided share of land in "SARVA-1" organized and constructed in land bearing revenue survey No. 184/11 & 184/12, T.P Scheme No.6, Final Plot No. 60/1 & 60/2 of moje savad in Dist. & Sub Dist. Vadodara & bounded as under : East: Raw- House Duplex No. 52 & 53, West: Society Road, North: Raw- House Duplex No. 28, South: Raw- House Duplex No. 30. Property Owned By WAGHELA NIKHILKUMAR	A) 17-04-2021 B) Rs. 34,89,116.63/- as on 30.06.2021 + Future Interest & Expenses thereon WEF 01.07.2021 C) 01-07-2021 D) Symbolic	A) Rs. 30.60 B) Rs. 3.06 (11-Aug-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
10.	PNB ANKLESHWAR (073600)	Mr Yatendrasingh Rajput & Mrs. Prachi singh Rajput Address (Borrower) (House) G/1/2, Anuradha Apartment, Madhuvan Society, GIDC Ankleshwar, Bharuch-393002.	Registered Mortgage of Plot No F-24, Built Up area Adm 393.28 Sq Mtrs, Plot Area Adm. 1114.83 Sq Mtrs, Garden City Paiki R.S. No.902, Village Kosamdi, Sub Dist Ankleshwar Dist Bharuch in favour of Mr Yatendra singh Rajput by Reg. Sale Deed No. 12477, dated 11-12-2018 and so also the construction and superstructure built to be built thereon together with all rights of easements of all kinds appurtenant ther to.	A) 20.04.2021 B) Rs. 1,39,37,294.75/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 02.07.2021 D) Symbolic	A) Rs. 158.93 B) Rs. 15.90 (11-08-2021) C) Rs. 0.25	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
11.	ANAND (100800)	Mr. Prakash Kantibhai Parmar (Borrower)	1. Residential House Residential Property Revenue Survey No.240/2, Adm. HC 0-28-33 ca area NA land paiki Sub Plot Nol. C/10 Adm. 128.64 Sq. Mtrs. N.A. Land with House o Mouje Jitodia, Taluka & Distt. Anand, Gujarat. Property Owned By Rekhaben Prakashbhai Parmar	A) 03-12-2021 B) Rs. 6,67,697.86/- + Future Interest & Expenses thereon C) 25-06-2021 D) Symbolic	A) Rs. 25.59 B) Rs. 2.56 (11.08.2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
12.	PNB-ATMAJYOTI ASHRAM (340800)	SIKANDAR BHAGALPRASAD KORI	Registration District Vadodara, Sub District Vadodara, Village Gorwa, R.S No 2472,249,251, 351,258,259,260,272,273,274 & 315 in the Scheme No -300 + 96 (M.I.G) in that Ground Floor Flat No-328 having built-up construction area 52.39 Sq. mtrs. In Surbhi Park (Gujarat housing Board) Gorwa, Vadodara Property Owned By Mr. Sikandar Bhagalprasad Kori	A) 16-07-2018 B) Rs. 10,43,799.37 + Future Interest & Expenses thereon C) 23-10-2018 D) Symbolic	A) Rs. 19.16 B) Rs. 1.92 (11-08-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
13.	PNB-ATMAJYOTI ASHRAM (340800)	SURESHBHAI CHHOTABHAI HARIJAN	Registration District Vadodara, Sub District Vadodara, Gorwa, R.S No-572 part, admeasuring about 19352.25 Sq. mtrs., in that Block No-E/103, having plot area 49.95 Sq.mtrs., with proportionate share of undivided common road-plot area 31.09 Sq. mtrs., having built-up area construction area 33.58 Sq. mtrs., in Ambika Park, Nr. Canal, Next to Petroffs Township, Gorwa Vadodara 390016. Property Owned By Mr. Sureshbhai Chhotabhai Harijan	A) 20-10-2014 B) Rs. 11,46,956.74 + Future Interest & Expenses thereon C) 28-08-2015 D) Symbolic	A) Rs. 16.51 B) Rs. 1.65 (11-08-2021) C) Rs.0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
14.	PNB ANKLESHWAR (073600)	FICHADIVYA VISHAL DILIPBHAI	All the Piece and parcels over land bearing City Survey No. 2233,2251/B-1, 2251/B-2 Mulaji kalyanj Tower, Municipal no. 286/22, ward No. 7 Flat No. 403 on Fourth Floor Admeasuring of 42.06 Sq. Mtrs Situated in sim of Village Limit AnkleshwarTa- Ankleshwar, Dist- Bharuch. Property Owner Name:- MR. FICHADIVYA VISHAL DILIPBHAI	A) 29.04.2021 B) Rs. 10,60,336.00/- as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 02.07.2021 D) Symbolic	A) Rs. 9.50 B) Rs. 0.95 (11-08-2021) C) Rs. 0.10	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
15.	PNB FATEHGANJ (340500)	M/S SHREEJI SALES CORPORATION Address (Borrower) Office:16,Anandagar Apartment, urmi Society, Jetalpur Road, Vadodara- 390007 Guarantor: 1. Jagrutiben B Shah (Guarantor) W/O Bharatbhai Navnitilal Shah, Door No 16, Anandnagar Apartment, Urmi society, Near New India Mill Road, Jethalpur Road, Vadodara 390007 2. Dhaval B Shah (Guarantor) S/O Bharatbhai Navnitilal Shah, Door No 16, Anandnagar Apartment, Urmi society, Near New India Mill Road, Jethalpur Road, Vadodara 390007 3. Deepak R Shah (Guarantor) 10-10A, Bahavani Park Society, Opp old petrol Pump road, Dindori Road, Nashik - 422001, Maharashtra. 4. Amit R Trivedi (Guarantor- for a part portion) Flat No 211- 212, Blue Daimond complex Fatehganj, Vadodara- 390002, Gujarat	All that piece and parcel of land situated at registration district Vadodara and sub district Vadodara, Moje : Jetalpur, RS no 106/A/1, CS no 1138 to 1140 Admeasuring 0-17-50 Sq mtr Paiki Flat No 16, on 2nd floor of Anand Sagar Apartment, Urmi Society Jetalpur Road, Vadodara, Flat admeasuring 1250 Sq mtr + 800 Sq Ft additional construction with open terrace on eastern side admeasuring 250 sq ft with garage no 8, on Ground Floor. Property owned by Shri Bharat Navnitilal Shah, & Smt. Jagruti Bharat Shah	A) 16.04.2021 B) Rs. 2,65,64,641.77 as on 30-06-2021 + Future Interest & Expenses thereon C) 06.07.2021 D) Symbolic	A) Rs. 82.00 B) Rs. 8.20. (11-08-2021) C) Rs. 0.25	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		
16.	PNB-NIZAMPURA (514410)	Owner Smt. Sarojben Sudarshan Joshee - Mother and legal heirs of deceased Vikrant Sudarshan	All that piece and parcel of Block No-D-48, having plot area admeasuring 57.07 sq.mtr and undivided share in road and common plot admeasuring 66.778 sq.mtr. with construction area 40.57 sq.mtr. in Rajnagar Society lying being situated on the land bearing R.S.396/1,397 & 406 Block no.247/1,247/2 of village moujekarapuri, Taluka and District- Vadodara and bounded as under:- East: Block No.-D-47, West: Block No.- D-49, North: 7.50 mtrs Society Road, South: Block No.D-55, (Owner- Smt. SarojbenSudarshanJoshee- Mother and legal heirs of deceased Vikrant SudarshanJoshee) (Symbolic)	A) 01-04-2016 B) Rs. 23,50,881.00/- C) 04-06-2016 D) Symbolic	A) Rs. 14.03 Lacs B) Rs1.40Lacs (11.08.2021) C) Rs.0.25	(12-08-2021) From 11.00AM To 04.00 PM (with extension of 10 minutes if necessary)		

TERMS AND CONDITIONS OF E-AUCTION SALE 1. The sale shall be subject to the Terms & Conditions prescribed in the Security Interest (Enforcement) Rules 2002 and to the following further conditions. (1) The auction sale will be "online through e-auction" portal <http://www.mstccomerce.com>/2. The intending Bidders/ Purchasers are requested to register on portal (<https://www.mstcauction.com>) using their mobile number and email-id. Further, they are requested to upload requisite KYC documents. Once the KYC documents are verified by e-auction service provider (may take 2 working days), the intending Bidders/ Purchasers has to transfer the EMD amount using online mode in his Global EMD Wallet by 11.08.2021 by 4.00 PM before the e-Auction Date and time in the portal. The registration, verification of KYC documents and transfer of EMD inwallet must be completed well in advance, before auction. 3. Earnest Money Deposit (EMD) amount as mentioned above shall be paid online through 3 mode i.e. NEFT/ Cash/ Transfer (After generation of Challan from [https://www.mst](https://www.mstccomerce.com)

સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું, ૯૦ ટકા બિલ્ડિંગ્સને ઇજ મળી શકે એમ નથી ફાયર સેફ્ટીને લઈ ગુજરાત હાઈકોર્ટ લાલધમ- ફક્ત કાયદાથી નહીં ચાલે કોઈ નક્કર પગલાં લો

(પ્રતિનિધિ) અમદાવાદ, તા.૯ રાજ્યના અનેક શહેર અને બિંદામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે બાંધકામો અને ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલો તથા અન્ય એકમો સામે ગુજરાત હાઈકોર્ટ લાલ આંખ કરી છે અને રાજ્યમાં અવારનવાર બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં લઈ રાજ્યસરકારને ફાયર સેફ્ટીના નિયમની યોગ્ય અમલવારી માટે સુચન પણ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટ આજે સુનાવણી દરમિયાન રાજ્યસરકારની ઝાટકણી કાઢતા સાફ શબ્દોમાં કહ્યું કે, ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારી જરૂરી છે. ફાયર સેફ્ટી એક્ટ લાગુ થયા બાદ ગેરકાયદેસર ઇમારતો મામલે બિલ્ડર અને અધિકારીઓ સામે પગલા લેવાયા હોય એવી માહિતી આપો. ફક્ત કાયદાથી નહીં ચાલે કોઈ નક્કર પગલા લેવાય એ જરૂરી છે.

ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, આ મુદ્દે રાજ્યસરકાર સક્રિય વિચાર સાથે કામ કરી રહી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, અમે એજ કહીએ છીએ કે રાજ્યસરકાર સક્રિય રીતે આ મામલે શું કરી રહી છે. કોઈ પરિવર્તન થયું હોય તેવું દેખાતું નથી રહ્યું. એડવોકેટ જનરલે કહ્યું કે, અમે નોટિસ આપી રહ્યા છીએ કે તમારું કન્સ્ટ્રક્શન પ્લાન મુજબ કરો નહીં તો સમય બાદ ડીમોલિશ કરીશું અથવા ઓડિનન્સ લાવીશું, સરકારે બિલ્ડિંગ યુઝ પરમિશન વિનાની ૯૦ ટકા બિલ્ડિંગ્સને ઇજ મળી શકે એમ જ ન હોવાનો સ્વીકાર કર્યો હતો. જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, જી.ડી.સી.આર. મુજબ ના થતું હોય તો સમય આપવાનો અર્થ શું છે. તાત્કાલિક પગલા નહીં ભરો તો

કંઈ નહીં થાય અને ફરીથી આ જ પ્રકારની સ્થિતિ આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે, આ પહેલા પણ અનિયમિત બાંધકામોને નિયમિત કરવા બાબતનો કાયદો લાગ્યો હતા તેનું શું થયું? અધિકારીઓએ પોતાનું કામ કર્યું છે અને જેમણે નથી કર્યું તેમની સામે શું પગલા લઈ રહ્યા છે? કેટલા બિલ્ડિંગ્સ સામે કાર્યવાહી કરી? જે લોકો હેતુ ફેર કરીને બિલ્ડિંગનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે તે બિલ્ડિંગ ઓક્યુપાઇ કરે ત્યારે ઇંજના હોય તો ગટર, પાણી અને વીજળીના કનેક્શન શા માટે કાપતા નથી? કોર્ટે હાલના અનિયમિત બાંધકામો બાબતે યોગ્ય રસ્તો કાઢવા અને ભવિષ્યમાં હાલ જેવી પરિસ્થિતિ ઉભી ના થાય એનો કાયમી ઉકલ લાવવા આખરી તક તરીકે એક મહિનાનો સરકારને સમય આપ્યો હતો.

જામનગર ખાતે બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા હીરક જયંતિની ઉજવણી



અમદાવાદ, ૦૯ જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા ૦૮ જુલાઈના રોજ હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુગપુત્રજી અર્પણ કર્યો હતો. ઉપસ્થિત સૈનિક સ્કૂલ સમકક્ષ સાથ, સમકક્ષ વિકાસની પણ રજૂઆત કરે છે. ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે મુખ્ય અધિકારી હીરક જયંતિની ઉજવણી બદલ અને આ હીરક જયંતિ વર્ષે છઠ્ઠા ધોરણમાં ઇંગ્લીશની પ્રથમ બેઠકને પ્રવેશ આપવા બદલ તમામ અધિકારીઓ, સ્ટાફ અને કેટેગોરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ખાખી ગણવેશ પહેરીને રાષ્ટ્રની સંરક્ષણ સેવાઓમાં યોગદાન આપતી ગુજરાતની દીકરીઓને જોવા માંગે છે. તેમણે ઓનલાઇન માધ્યમથી બોધવેલા સૂક્ષ્મ કેટરને ભારપૂર્ક કહ્યું હતું કે, તેઓ હોમશા માટે અને ઈંચા વિચારો રાખો અને ક્યારેય નિષ્ફળતાનો નાસીપાસ ના થાય. તેમણે તમામ વિદ્યાર્થીઓને આપનારા દિવસો માટે ખુબ જ સારી સફળતાની શુભેચ્છા પાઠવી હતી. અંતે, બાલાચડી સૈનિક સ્કૂલના નાણા આચાર્ય ડિવેન્દ્ર કમાન્ડર મનુ ચૌધરીએ આભાર વચન રજૂ કર્યા હતા અને સૂક્ષ્મ ગીતની રજૂઆત સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

લાવનગર, રાજકોટ, અમદાવાદમાં જીએસટીના વ્યાપક દરોડા રૂ. ૧૦૦૦ કરોડથી વધુનું બોગસ બિલ્ડિંગ કોલ્માંડ, કરચોરીનો આંક હજુ પણ વધે તેવી શક્યતા

(પ્રતિનિધિ) અમદાવાદ, તા.૯ રાજ્યના જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગે ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં પાટી રૂ. ૧૦૦૦ કરોડથી વધુનું બોગસ બિલ્ડિંગ કોલ્માંડ ઝડપી લીધું હોવાનું જીએસટીના ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે હજુ પણ આ તપાસનો દોર ચાલુ છે અને બોગસ બિલ્ડિંગ કોલ્માંડનો આંક હજુ વધુ બમ તેવી પુરી શક્યતા છે. જીએસટી વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગને મળેલી ગુપ્ત બાતમીના આધારે જીએસટીના અધિકારીઓ અને ઈન્સ્પેક્ટરોની બુટી બુટી ટુકડીઓ ભાવનગર, રાજકોટ અને અમદાવાદમાં ૭૦ જેટલા બુટ બુટ વેપારી એકમોના

સ્થળોએ ટ્રાકટી હતી અને બોગસ બિલ્ડિંગ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં મોટાભાગના વેપારીઓ લોખંડ ભંગાર અને કોપર સ્કેપના છે. અહીં નોંધવું ઘટે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મોટાભાગે લોખંડ ભંગાર અને કોપર સ્કેપ કોમોડીટીમાં બોગસ બિલ્ડિંગનું કોલ્માંડ થઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના આધારે જીએસટી વિભાગે ભાવનગર, રાજકોટ વેપારી એકમોની તપાસ હાથ ધરતા રૂ. ૧ હજાર કરોડથી વધુનું બોગસ બિલ્ડિંગ કોલ્માંડ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જીએસટી વિભાગને બાતમી મળી હતી કે મુળ ભાવનગરનો અને હાલ અમદાવાદનો અફઝલ સલવાણી

નામનો શબ્દ ૨૦ જેટલી બોગસ કંપનીઓ ઓપરેટ કરી અને બોગસ બિલ્ડિંગ કોલ્માંડ કરી રહ્યો છે. આથી જીએસટીની ટીમોએ અત્યંત ગુમ રાહે આ શબ્દને શોધી કાઢ્યો હતો. આ શબ્દને અત્યાર સુધીમાં ૭૦૦ કરોડથી વધુ બોગસ બિલ્ડિંગ કોલ્માંડ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હજુ આ શબ્દની પુષ્ટિ ચાલુ છે ત્યારે હજુ મોટું કોલ્માંડ નીકળવાની પુરી શક્યતા છે. દરમિયાન અફઝલ પાસેથી ભાવનગરમાં કેટરની અને અમદાવાદમાં ઓફીસ ધરાવતી માધવ કોપર પ્રા.લી. નામની પેઢીએ પણ મોટા પાયે ખોટી કેડીટ લીધી હોવાનું ધ્યાન આવતા રૂ. ૮૦ કરોડથી વધુની કરચોરી ખુલ્લા પ્રામી છે. જીએસટી વિભાગની ટીમે આ પેઢીના સાત થી આઠ સ્થળોએ દરોડા પાટી તપાસ હાથ ધરી છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે બાળકો ને ૨૧ વર્ષની વય સુધી માસિક રૂ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, તા.૯ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોરોનામાં માતા પિતાની છત્ર છાયા ગુમાવતા અનાથ અને નિરાધાર બાળકોને સહાય આપવા માટે 'બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા 'મોકળા મને' સંવાદ કાર્યક્રમમાં સંવેદનશીલ બહેનરાત કરી હતી કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના' હેઠળ હવે બાળકો ને ૨૧ વર્ષની વય સુધી માસિક રૂ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ ૧૮ વર્ષની હતી તે વયસ્તરીને હવે ૨૧ વર્ષની કરવામાં આવી છે. એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય ૨૧ વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને ૪૦૦૦ ની સહાય આવા બાળક ને આપશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સી.એમ. કોમન મેન તરીકે રાજ્યના વિવિધ સમાજ-વર્ગો સામે મુક્ત મને સંવાદ-ગોષ્ઠી માટે શરૂ કરેલી મોકળા મને સંવાદ શુંબલાની વધુ એક કડી સંપન્ન કરી હતી. તદઅનુસાર, મુખ્યપ્રધાને કોરોના સંક્રમણના આ કાળમાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બન્યા છે તેવા બાળકોને મુખ્યપ્રધાન નિવાસસ્થાને બોલાવીને તેમની સાથે લાગણીસભર સંવાદ પિતૃવાત્સલ્ય ભાવથી કર્યો હતો. રાજ્યના ૩૩ બિંદાઓમાંથી આવા ૩૫ જેટલા

નિરાધાર-અનાથ બાળકોને મુખ્યપ્રધાન નિવાસસ્થાને વિજયભાઈ રૂપાણી સાથે સીધા સંવાદની આ મોકળા મને કાર્યક્રમ અંતર્ગત તક મળી હતી. બાળકો સાથે તેમના પાલક વાલીઓ પણ જોડાયા હતા. મુખ્યપ્રધાને ભારપૂર્ક કહ્યું કે, કોરોનાને કારણે નિરાધાર થયેલા બાળકોનો ભવિષ્યનો વિચાર કરીને જ રાજ્ય સરકારે 'મુખ્યમંત્રી બાળ સહાય યોજના' શરૂ કરી છે. નિરાધાર બાળકોનું ભવિષ્ય રોગાઈ ન બંધ તેની સંપૂર્ણ સંવેદનશીલ બાળકના વાલી બનીને બાળકના આધાર બનવાનો સેવા યજ્ઞ આ રાજ્ય સરકારે આદર્યો છે. કોરોના મહામારીના આ સંક્રમણ દરમિયાન જે બાળકોના માતા-પિતા બંનેનું અવસાન થયું છે તેવા બાળકોના ભણતર, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ-લોન અને સહાય પૂરી પાડવા આ યોજના શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની એન.ડી.એ સરકારને સફળ સાત વર્ષ પૂર્ણ થવા અવસરે આ 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના' ગુજરાતમાં કોરોનાથી માતા-પિતા ગુમાવી ચૂકેલા નિરાધાર બાળકો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ શરૂ કરવામાં આવી છે. ગુજરાતે બાળકોના બાળપણથી લઈને રોજગાર મળતાં સુધીની સર્વાંગી કવચાણ યોજના શરૂ કરવાની પથદર્શક પહેલ કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. જેમના માતા-પિતા બંનેનું

કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા પ્રત્યેક બાળકને આવક મર્યાદા ધ્યાને લીધા વિના ૧૮ વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર આપવામાં આવેલી છે. રાજ્યભરમાં આવા ૭૭૬ જેટલા નિરાધાર બાળકોને બાળક દીઠ રૂ. ૪,૦૦૦ની સહાય અન્યથે હજુ બે દિવસ પહેલાં જ કુલ ૩૧.૦૪ લાખની સહાય ડી.બી.ટી. થી બેંક ખાતામાં આપવામાં પણ આવેલી છે. ૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોક્ષન લાભી અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત આપવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણમાં પણ નિરાધાર બાળકોને તબજાત મળશે. ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક-યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્યથે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ પણ આપવામાં આવશે. એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણાશે.

અમદાવાદ, ૦૯ જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા ૦૮ જુલાઈના રોજ હીરક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુગપુત્રજી અર્પણ કર્યો હતો. ઉપસ્થિત સૈનિક સ્કૂલ સમકક્ષ સાથ, સમકક્ષ વિકાસની પણ રજૂઆત કરે છે. ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે મુખ્ય અધિકારી હીરક જયંતિની ઉજવણી બદલ અને આ હીરક જયંતિ વર્ષે છઠ્ઠા ધોરણમાં ઇંગ્લીશની પ્રથમ બેઠકને પ્રવેશ આપવા બદલ તમામ અધિકારીઓ, સ્ટાફ અને કેટેગોરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ખાખી ગણવેશ પહેરીને રાષ્ટ્રની સંરક્ષણ સેવાઓમાં યોગદાન આપતી ગુજરાતની દીકરીઓને જોવા માંગે છે. તેમણે ઓનલાઇન માધ્યમથી બોધવેલા સૂક્ષ્મ કેટરને ભારપૂર્ક કહ્યું હતું કે, તેઓ હોમશા માટે અને ઈંચા વિચારો રાખો અને ક્યારેય નિષ્ફળતાનો નાસીપાસ ના થાય. તેમણે તમામ વિદ્યાર્થીઓને આપનારા દિવસો માટે ખુબ જ સારી સફળતાની શુભેચ્છા પાઠવી હતી. અંતે, બાલાચડી સૈનિક સ્કૂલના નાણા આચાર્ય ડિવેન્દ્ર કમાન્ડર મનુ ચૌધરીએ આભાર વચન રજૂ કર્યા હતા અને સૂક્ષ્મ ગીતની રજૂઆત સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

છૂટાછેડા બાદ પત્નીએ બીજા લગ્ન કરી લેતા પૂર્વ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

વડોદરા, તા.૯ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંબાવ ગામમાં છૂટાછેડા લીધા બાદ મહિલાના બીજા જગ્યાએ લગ્ન નક્કી થઈ જતા પૂર્વ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. જેને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી હતી. પાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંબાવ ગામમાં રહેતા અને હેર સલૂનની દુકાન ધરાવતા ૨૭ વર્ષીય ભાવેશ મનહરભાઈ નાઈનો દ વર્ષ પહેલાં શાંતિની જ યુવતી સાથે થયા હતા. નાઈ દંપતીને ૫ વર્ષનો પુત્ર હતો. બંને વચ્ચે કોઈ

કારણસર અણબનાવ બનતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો અને સમાજના વડીલો તેમજ બંને પરિવારના વડીલો વચ્ચે સમાધાનનો કોઈ અવકાશ ન જણાતા ભાવેશને તેની પત્નીના ઈચ્છાએ અર્થ બેલાન જેવી છૂટાછેડા બાદ પત્ની તેના ૫ વર્ષના પુત્રને લઈને વિદ્યાર્જી રહી હતી, ત્યારબાદ પૂર્વ પતિનું અન્ય સ્થળે બીજા લગ્ન ગોઠવાઈ ગયા હતા. જે

અંગેની જાણ પૂર્વ પતિ ભાવેશને થતાં તેઓ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા હતા જેના કારણે ભાવેશે આવીશમાં આવીને ઝેરી દવા ગટગટાવી ગયો હતો, જેથી તેની તબિબત લેવાતા અર્થ બેલાન જેવી હાલતમાં સારવાર અર્થે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મુશાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ વડોદરા સાથે તુફાનની વરસુઅલ સિટી ટુર શરૂ કરી

વડોદરા, ૦૯ એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તુફાન લોચ પહેલાં પરેશ રાવલ, ફરહાન અખ્તર, મુશાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની ટીમે વડોદરા સાથે વરસુઅલ સિટી ટુરની શરૂઆત કરી હતી. પોતાના પ્રકારની પ્રથમ વરસુઅલ ટુરમાં તેઓ મીડિયા, ચાહકો તેમજ વિવિધ હીરો સાથે કરતાં જોવા મળશે. ફિલ્મના મુખ્ય અભિનેતા અને કો-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે તુફાન માટે તેમની પ્રથમ વરસુઅલ સિટી વિઝિટ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતના બીજા રાજ્યોની માફક ગુજરાત સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રેરણાદાયી વાર્તાઓની જમીન છે. તે દેશના કેટલાક મહાન રમતવીરોનું ઘર છે અને તેમના યોગદાનથી આપણને ગર્વ અપાય છે. એક પ્રોડ્યુસર અને એક્ટર તરીકે મને વડોદરાના સ્થાનિક મીડિયા સાથે થયાં કરવાની તક મળવા અંગે હું ખુશ છું, જેનાથી હું તેમને તુફાનની પાવરફુલ અને પ્રેરણાદાયી સ્ટોરી અંગે જાણકારી આપી શક્યો છું. આ વર્ષોમાં રાજ્ય તરફથી મળેલા પ્રેમ અને સહયોગને શોભા આનંદ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, તુફાન સાથે મેં બીજાં છે કે એક વ્યક્તિ શારીરિક રીતે ગમે તેટલો મજબૂત હોય, પરંતુ પોસ્ટર હોવું કંઈક અલગ જ વાત છે. મેં ટવીટ મહિના સખત શારીરિક તાલીમ લીધી છે અને આ ભૂમિકા માટે માનસિક રીતે સજ્જ બન્યો છું. આ ભૂમિકા મારા હૃદયની ખુબજ નજીક છે. એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા એક્સલ એન્ટરટેઇનમેન્ટ અને આરઓએમપી પિક્ચર્સ સાથે પ્રસ્તુત તુફાન એક પ્રેરણાદાયી સ્પોર્ટ્સ ડ્રામા છે, જેને સિરિશ સિંઘવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે.

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મુશાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની ટીમે વડોદરા સાથે વરસુઅલ સિટી ટુરની શરૂઆત કરી હતી. પોતાના પ્રકારની પ્રથમ વરસુઅલ ટુરમાં તેઓ મીડિયા, ચાહકો તેમજ વિવિધ હીરો સાથે કરતાં જોવા મળશે. ફિલ્મના મુખ્ય અભિનેતા અને કો-પ્રોડ્યુસર ફરહાન અખ્તરે તુફાન માટે તેમની પ્રથમ વરસુઅલ સિટી વિઝિટ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતના બીજા રાજ્યોની માફક ગુજરાત સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રેરણાદાયી વાર્તાઓની જમીન છે. તે દેશના કેટલાક મહાન રમતવીરોનું ઘર છે અને તેમના યોગદાનથી આપણને ગર્વ અપાય છે. એક પ્રોડ્યુસર અને એક્ટર તરીકે મને વડોદરાના સ્થાનિક મીડિયા સાથે થયાં કરવાની તક મળવા અંગે હું ખુશ છું, જેનાથી હું તેમને તુફાનની પાવરફુલ અને પ્રેરણાદાયી સ્ટોરી અંગે જાણકારી આપી શક્યો છું. આ વર્ષોમાં રાજ્ય તરફથી મળેલા પ્રેમ અને સહયોગને શોભા આનંદ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, તુફાન સાથે મેં બીજાં છે કે એક વ્યક્તિ શારીરિક રીતે ગમે તેટલો મજબૂત હોય, પરંતુ પોસ્ટર હોવું કંઈક અલગ જ વાત છે. મેં ટવીટ મહિના સખત શારીરિક તાલીમ લીધી છે અને આ ભૂમિકા માટે માનસિક રીતે સજ્જ બન્યો છું. આ ભૂમિકા મારા હૃદયની ખુબજ નજીક છે. એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા એક્સલ એન્ટરટેઇનમેન્ટ અને આરઓએમપી પિક્ચર્સ સાથે પ્રસ્તુત તુફાન એક પ્રેરણાદાયી સ્પોર્ટ્સ ડ્રામા છે, જેને સિરિશ સિંઘવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે.

પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ ટુ ગાંધી વચ્ચે દોડતી વિશેષ ટુરની ટ્રીપ્સને લંબાવાઈ

ટ્રેન નં.	કયાંથી	કયાં સુધી	સેવાના દિવસો	સુધી લંબાયેલ
૦૨૨૦૦	બાંદ્રા ટર્મિનસ	ગાંધી	શનિવાર	૨૭.૧૧.૨૦૨૧
૦૨૧૯૯	ગાંધી	બાંદ્રા ટર્મિનસ	ગુરુવાર	૨૭.૧૧.૨૦૨૧

રોડાઇ સંબંધિત વિગતવાર સમગ્ર માટે કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લો.

ફક્ત આરક્ષિત ટિકિટ ધરાવતા મુસાફરો જ આ વિશેષ ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે.

મુસાફરોને બોર્ડિંગ દરમિયાન, મુસાફરી દરમિયાન અને લવચસ્થાન દરમિયાન તમામ ધોરણો, COVID-19 થી સંબંધિત એસ.ઓ. પી.નું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

ટ્રેન નંબર ૦૨૨૦૦ ની લંબાયેલ ટ્રીપ્સનું બુકિંગ ૧૦ મી જુલાઈ, ૨૦૨૧ થી નામાઈલ પીસાઓસ ટાઈમ્સ અને આઈઆરસીટીની વેબસાઈટ પર પુલવે. ઉપરની સંપૂર્ણ આરક્ષિત ટિકિટ લઈને લેવાશે.

પશ્ચિમ રેલવે
www.wr.indianrailways.gov.in
નંબર ૧૬૬૩૩૩૩
સેવાઓ: www.wr.indianrailways.gov.in

બધી આરક્ષિત ટિકિટો માટે ઓળખપત્ર સાથે રાખો.

ગુજરાત રાજ્ય	
અમદાવાદ મેકાન વિભાગ (યાંત્રિક) ટેન્ડર નોટીસ નં. ૧ સને ૨૦૨૧-૨૨	
૧. કામનું નામ	કાંટોંગ ઓસ.ડી.એ. (L.D.O.) કોમ્પોઝિંગ (પીસી) ડેપુ ટુ સચાલકપુરા ડી.એમ. પ્લાન્સ સાઇટ, વડોદરા
૨. કામની અંદાજિત રકમ	રૂ. ૭૮.૩૦૦/-
૩. કોસ ટેન્ડર આપવાની છેલ્લી તારીખ	તા. ૧૭/૦૭/૨૦૨૧ . ૧૮.૦૦ કલાક
૪. ભાવ ભરેલ ટેન્ડર રજૂ. એડી/ સ્પીડ પોસ્ટથી પરત મોકલવાની છેલ્લી તારીખ	તા. ૨૬/૦૭/૨૦૨૧ . ૧૮.૦૦ કલાક
૫. ટેન્ડર ખોલાવાની સંબંધિત તારીખ	તા. ૨૭/૦૭/૨૦૨૧. ૧૨.૦૦ કલાક
૬. કચેરીનું નામ તથા સરનામું	નાયબ કાર્યપાલક ઇન્જનેરીની કચેરી, વડોદરા વાંચક(મ.મ) પેટા વિભાગ નં.૨, ૨૯વે ગોદી, પેટરોડમ-૧ ની સામે, જાણી રોડ, વડોદરા-૩૯૦ ૦૦૨. ફોન : ૦૨૬૫ - ૨૭૬૩૭૩

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી વતી નાયબ કાર્યપાલક ઇન્જનેરી, વાંચક (મા.મ) પેટા વિભાગ નં. ૨, વડોદરા દ્વારા આ કામ માટે અનુભવી ઇજનેરી/સીવિલ/મેકેનિક પાસેથી સીલ બંધ કરવામાં આવી છે. આ વાંચક ભાવે મંગાવવામાં આવે છે. ઇમ્પાન્ટેડ વેડ પર અરજી સાથે ઇજનેરી/સીવિલ/મેકેનિક, પાન કાર્ડની નકલ, એજન્ટના ઓ.ડી.એ. ટેકરની નકલ આર.સી.ડી.એ. પ્રમાણિત નકલ, આ પ્રકારના અનુભવનું પ્રમાણપત્ર તથા ટેન્ડર ફી રૂ. ૩૦૦/- ભરેલી કોસ ટેન્ડર ડીપોઝિટ કચેરી સમય ૧૨.૦૦ થી ૧૬.૦૦ દરમિયાન મળી શકશે. પોસ્ટ થી ટેન્ડર મંગાવવાને ટેન્ડર ટીક રૂ. ૧૫૦/- ધરાવનાર જમા કરાવવામાં રહેશે. કોઈપણ કે બધા ટેન્ડર અસ્વીકારવાનો ખાતાનો અધિકાર અધ્યક્ષિત રહેશે. વધુ વિગતો માટે અરેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. (માહિતી-વડો-૨૧૨-૨૧-૨૨)

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-યેન્નાઈ સેન્ટ્રલ અને ઈંદોર-લિંગમપલ્લી સામાજિક હમસફર વિશેષ ટ્રેનો લંબાવી

ટ્રેન નં.	પ્રારંભ સ્ટેશન અને ગંતવ્ય સ્થાન	સેવાનો દિવસ	તારીખથી વિસ્તાર
૦૮૨૨૦	અમદાવાદ-યેન્નાઈ સેન્ટ્રલ	સોમવાર	૧૨.૦૭.૨૦૨૧
૦૮૨૧૯	યેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ	બુધવાર	૧૪.૦૭.૨૦૨૧
૦૮૦૧૬	ઈંદોર-લિંગમપલ્લી	શનિવાર	૧૭.૦૭.૨૦૨૧
૦૮૦૧૫	લિંગમપલ્લી-ઈંદોર	રવિવાર	૧૮.૦૭.૨૦૨૧

આ ટ્રેનો આગળના આદેશ સુધી ચાલશે
વિરામસ્થાનના સમયપત્રકની વિગતવાર માહિતી માટે જુઓ www.enquiry.indianrail.gov.in

માત્ર ક-ફર્મ ટિકિટધારક મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેન-સમાં બેસવા દેવાશે

મુસાફરોને વિનંતી છે કે ટ્રેનમાં બેસવા, મુસાફરી દરમિયાન અને ગંતવ્યસ્થાને કોવિડ-૧૯ના તમામ ધોરણો, પ્રક્રિયાઓના ધારાધોરણો (એસઓપીસ) પૂરેપૂરા પાડવો.

પશ્ચિમ રેલવે
www.wr.indianrailways.gov.in
નંબર ૧૬૬૩૩૩૩
સેવાઓ: www.wr.indianrailways.gov.in

મહેરબાની કરીને તમામ રિઝર્વ ટિકિટ્સ માટે આઈડી મૂક સાથે રાખવા

અપાર ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ
(CIN : L9110GJ1989PLCO12802)
રજી.ઓફિસ : ૩૦૧, પાલોડા કોમ્પ્લેક્સ, આર.સી

National Stock Exchange of India Ltd. "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai – 400 051. Scrip Symbol : APARINDS <u>Kind Attn.: The Manager, Listing Dept.</u>	BSE Ltd. Corporate Relationship Department, 27 th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001. Scrip Code : 532259 <u>Kind Attn. : Corporate Relationship Dept.</u>
---	--

Sub: Submission of publication of advertisement regarding 32nd Annual General Meeting in the newspapers (Post-despatch)

Ref: Intimation under Regulation 30 and all other applicable regulations, if any, of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time.

Dear Sir,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, please find enclosed herewith the copies of newspaper advertisement published in Business Standard, (English language newspaper having Nationwide Circulation) and Vadodara Samachar, (Gujarati language newspaper) at Vadodara, in compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and the Secretarial Standards of General Meetings issued by the Institute of Company Secretaries of India, intimating that 32nd Annual General Meeting of the Company will be held on Friday, August 13, 2021 at 2.30 pm (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

The above information is also available on the website of the Company www.apar.com.

This is for your information and record.

Thanking you,

Yours faithfully,
For APAR Industries Limited



(Harishkumar Malsatter)
Assistant Manager – Secretarial & Legal

Encl. : As above

APAR Industries Limited

Regd Office: 301/306, Panorama Complex, RC Dutt Road, Alkapuri, Vadodara - 390007, India
+91 265 6178 700/6178 709 apar_baroda@apar.com www.apar.com

Corporate Office: APAR House, Corporate Park, V N Purav Marg, Chembur, Mumbai 400 071, India
+91 22 2526 3400/6780 0400 corporate@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802

વિજય બેંક Union Bank of India VIJAPUR Branch
Laxmikeshav Building, T.B. Road, Vijapur,
Dist. Mehsana, Gujarat. 382870

POSSESSION NOTICE
(Rule 8(1))

Whereas, The undersigned being the authorized officer of the **Union Bank of India** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice following dated calling upon the Borrower to repay the amount mentioned in the notice being within 60 days from the date of receipt of the said notice.

The borrower as well as guarantors having failed to repay the total amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on **09.07.2021**.

Borrower/Guarantor's attention is invited to provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the secured assets.

The Borrower/Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India** for the amounts and further interest and expense thereon.

Sr No.	Name of Borrowers / Guarantors / Branch	Demand Notice Date & Out. Amt.	DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
1	M/S PRAMUKH OIL INDUSTRIES, PARTNER- 1. Mr. BHARATKUMAR JIVANBHAI CHAUDHARY, 2. Mrs. CHAUDHARY SAVITA BHARATKUMAR, 3. Mr. KANUBHAI MANABHAI CHAUDHARY	06.04.2021 Rs. 1,55,43,913.07 as on 31.03.2021	Prime Security :- Hypothecation of Stock & receivables Collateral Security :- All the pieces and parcel of Industrial Property NA land measuring 8094 new Admeasuring 8151 sq mtr.) of NA S. No. 863 (old S. No. 479) of village -pivai, taluka -Vijapur, District Mehsana belongs to M/s Pramukh Oil Industries Boundries :- East-land Rev. Survey No. 476 & 478, West - Naliyu, North :- Limit of House and than after Naliyu, South - Survey No 480

Date : 15.07.2021, Place : Vijapur
Chief Manager & Authorised Officer

PUBLIC NOTICE FOR AUCTION CUM SALE (APPENDIX - IV A) (Rule 8(6))
Pursuant to taking possession of the secured asset mentioned hereunder by the Authorized Officer of **IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL HFL)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 for the recovery of amount due from borrower/s, offers are invited by the undersigned in sealed covers for purchase of immovable property, as described hereunder, which is in the possession, on "AS IS WHAT IS", "AS IS WHAT IS" and "WHATSOEVER THERE IS" BASIS particulars of which are given below:-

Borrower(s)/Co-Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date and Amount	Date of Physical Possession	Description of the Immovable property / Secured Asset
1. Mr. Maniruddin SK 2. Mrs. Rukshanabegam Shekh (Prospect No.878805)	03-Dec-2020 Rs.21,35,830/- (Rupees Twenty One Lakhs Thirty Five Thousand Eight Hundred Thirty Only)	03-Mar-2021 Total Outstanding as on 13-July-2021 Rs 21,47,726/- (Rupees Twenty One Lakh Forty Seven Thousand Seven Hundred and Twenty Six Only)	All that part and parcel of the properties bearing Sub Plot no. 123 +124-A, Hina Park-3, Plot no. 123 & 124, Revenue Survey no. 511, Bhuj, Gujarat -370001. Reserve Price (Rs.) Rs.17,50,000/- (Rupees Seventeen Lakh Fifty Thousand Only) Earnest Money Deposit (EMD) Rs.1,75,000/- (Rupees One Lakh Seventy Five Thousand Only) Concerned Branch:- IIFL Home Finance Ltd., Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr. Shell Petrol Pump, Anandnagar Road, Prahladnagar, Ahmedabad - 380051 (Authorized officer: Mr. Anshul Juneja @ 992999306)

Date of Inspection of Property: 27-July-2021
1100 hrs-1400 hrs

EMD Last Date: 30-July-2021
1100 hrs-1300 hrs

Date/Time of Auction: 05-Aug-2021
1100 hrs-1300 hrs

1. Date of inspection of the immovable property is 27-July-2021 between 1100 hrs - 1400 hrs.
2. Last date of submission of sealed offers in the prescribed tender forms along with EMD is 30-July-2021 till 5 pm at the branch office address.
3. Date of opening of the offers for the Property is 05-Aug-2021 at the above mentioned branch office address at 1100 hrs - 1300 hrs the tender will be opened in the presence of the Authorized Officer.
4. Further interest will be charged as applicable, as per the Loan Agreement on the amount outstanding in the notice and incidental expenses, costs, etc., is due and payable till its realization excluding legal and any incidental charges thereupon.
5. The notice is hereby given to the Borrower and Guarantor, to remain present personally at the time of sale and they can bring the intending buyers/purchasers for purchasing the immovable property as described herein above, as per the particulars of terms and Conditions of Sale.
6. The Borrower(s)/Guarantor(s) are hereby given 15 DAYS SALE NOTICE UNDER THE RULE 9 SUB RULE (1) OF SARFAESI ACT, 2002 to pay the sum mentioned above before the date of Auction falling which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to IIFL Home Finance Limited in full before the date of sale, auction is liable to be stopped.
7. The EMD shall be payable through DD in favour of "IIFL Home Finance Limited" payable at GURGAON and shall be submitted at the concerned branch/Corporate Office.
8. The detail terms and conditions of the auction sale are incorporated in the prescribed tender form. Tender forms are available at the above branch office, or also you can refer <https://www.iifl.com>
9. The immovable property will be sold to the highest bidder. However, the undersigned reserves the absolute discretion to allow inter se bidding, if deemed necessary.
10. Tenders that are not filled up or tenders received beyond last date will be considered as invalid tender and shall accordingly be rejected. No interest shall be paid on the EMD.
11. Company is not responsible for any liabilities upon the property which is not in the knowledge of the company.
For further details, contact: Mr. Anshul Juneja @ 992999306, Email:- anshul.juneja@iifl.com, Corporate Office : Plot No. 98, Phase-IV, Udyog Vihar, Gurgaon, Haryana-122015.
Place: Bhuj Date: 15-07-2021
Sd/- Authorised Officer For IIFL Home Finance Ltd. (IIFL HFL)

APAR APAR INDUSTRIES LIMITED
(CIN : L91110G1989PLC012802)

Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.
Phone : (0265) 2339906 ; Fax : (0265) 2330309 Website : www.apar.com, E-mail : com.sec@apar.com

NOTICE OF THE 32ND ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that:

- The Thirty-Second (32nd) Annual General Meeting (AGM) of the Shareholders of APAR Industries Limited ("the Company") will be held on **Friday, August 13, 2021 at 2:30 P.M. (IST)** through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM) in compliance with General Circular No. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020 and 02/2021 dated 13.01.2021 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars") vide which, companies are allowed to hold AGMs through VC / OAVM, without the physical presence of members at a common venue. Hence, the 32nd AGM of the Company shall be held through VCOAVM to transact the business as set forth in the Notice of the 32nd AGM dated May 31, 2021. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.
- In compliance with the Circulars, electronic copies of the Notice of the 32nd AGM and Annual Report 2020-21 have been sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). These documents are also available on the website of the Company at www.apar.com, Stock Exchange websites i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and also on the CDSL's website at <http://www.evotingindia.com>, an agency appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC. The dispatch of Notice of the AGM through emails has been completed on July 13, 2021.
- Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, August 7, 2021 to Friday, August 13, 2021, (both days inclusive) for the purpose of 32nd AGM and to determine the names of the shareholders who shall be entitled to receive the dividend on Equity Shares of the Company for the Financial Year 2020-2021, subject to deduction of tax at source ("TDS") where applicable.
- In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the following information is available to the Shareholders of the Company:

Members holding equity shares either in physical form or dematerialization form, as on the cut-off-date (Record date) Friday, August 6, 2021, may cast their vote electronically on the business as set forth in the Notice of the 32nd AGM dtd. May 31, 2021 through the electronic voting system of Central Depository Services (India) Limited (CDSL).

All the members are hereby informed that -

- The business as set forth in the Notice of the 32nd AGM dated 31st May, 2021, shall be transacted through remote e-voting and e-voting during the AGM;
 - The remote e-voting shall commence on Monday, August 9, 2021 (10.00 Hrs. IST);
 - The remote e-voting shall close on Thursday, August 12, 2021 (17.00 Hrs. IST);
 - The cut-off-date (Record date) for determining the eligibility to vote by remote e-voting and / or e-voting system at the AGM shall be Friday, August 6, 2021;
 - Any person, who acquires equity shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding equity shares as on the cut-off-date (Record date) i.e. Friday, August 6, 2021, may obtain / generate the login ID and password as per the instructions given in the Note no. 18 of the Notice of the 32nd AGM dtd. May 31, 2021.
 - Members may note that:
 - The remote e-voting module shall be disabled by CDSL beyond 17:00 Hrs. IST on Thursday, August 12, 2021 and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
 - The facility for e-voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM;
 - The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 - A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the depositories as on the cut-off-date (Record date) i.e. Friday, August 6, 2021 only shall be entitled to avail the facility of remote e-voting and / or e-voting at the AGM and for participation at the AGM.
 - The manner of voting remotely, for members holding shares in dematerialized mode / physical mode and for members who have not registered their email addresses, is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.apar.com to obtain such details.
 - Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants, are requested to register / update the same with the Depository Participants with whom they maintain their demat accounts and Members holding shares in physical mode, who have not registered / updated their email addresses / Bank Account Details with the Company, are requested to register / update the same with the Company by sending an e-mail at investor.services@apar.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN in order to facilitate the Company to serve the documents through the electronic mode and to receive copies of the Annual Report 2020-21 along with the Notice of the 32nd AGM, instructions for remote e-voting and e-voting during AGM and instructions for participation in the AGM through VC. Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Account Details on the link given below: https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html
 - The Company has appointed Mr. Hemang M. Mehta, Proprietor of M/s. H. M. Mehta & Associates, Practising Company Secretary, Vadodara, Gujarat as the Scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.
 - In case of any query, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual available at www.evotingindia.com under help section and for any grievances connected with e-voting facility, may contact Mr. Rakesh Dalvi, Senior Manager (022-23058542/43) at CDSL, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013, or send an email to helpdesk.evoting@cdslindia.com. The members who require technical assistance to access and participate in the meeting through VC may contact the above help line numbers.
- By Order of the Board
For APAR Industries Limited
Sanjaya Kunder
Company Secretary
- Place : Mumbai
Date : July 14, 2021

Bank of Baroda Vesu Branch, G-1, SNS Square, Vesu Gam Road, Vesu,
Surat-395 007, Gujarat, India. Ph.No. 0261 2215700/800
Email - vesu@bankofbaroda.com

APPENDIX IV [See Rule 8(1)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the authorized officer of the **BANK OF BARODA** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice upon the Borrower/ Guarantor/ Mortgagee to repay the amount mentioned in the notice being the amount with further interest and cost etc. Within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/ Mortgagees having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this date **09.07.2021**.

The Borrowers/Mortgagors attention is invited to provision of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda**.

Sr. No.	Borrower's/ Guarantor/ Mortgagee Name	Demand Notice Date & Amount(Rs.)	Description of the Property
1.	Mr. Pratik Rameshkumar Chandraresha and Mrs. Jayshri Ashokkumar Shah	13/04/2021 Rs. 74,02,524.00 as on 12-04-2021 further interest & charges thereon from 13-04-2021	All that piece and parcel of immovable property in the form of Residential Bungalow no. 65 (Block No. 85 as per Revenue Survey), admeasuring around 117.87 sq. mtrs. of plot area along with margin and construction of around 123.93 sq. mtrs. in society known and named as "Sovrin Bungalows" situated on land bearing Sub Plot No. 02 of the land bearing Revenue Survey no. 4477/1, Block No. 425/A/2 of village Knowlad, Taluka Kamrej, District Surat in the name of Mr. Pratik Rameshkumar Chandraresha and bounded as follows: North: Plot No. 64, South: Plot No. 66, East: Adjoining, Internal Road, West: Plot No. 86.
2.	Mr. Hareshbhai Rajabhai Shelana and Mrs. Vasantben Hareshbhai Shelana	19-04-2021 Rs. 26,41,174.00 interest thereon as on 18-04-2021 further interest & charges thereon from 19-04-2021	All that part and parcel of bungalow on Plot no. 105, admeasuring 100.54 sq. mtrs. And along with construction admeasuring 130.06 sq. mtrs. in society known as "SWAPNAVILLA" and undivided proportional share admeasuring 69.97 sq. mtrs. in common roads, and COP of the said society which is situated and developed on land bearing Block No. 343, Revenue Survey No. 356 & 357, moje village Kamrej, Taluka Kamrej, District Surat in the name of Mr. Hareshbhai Rajabhai Shelana and bounded as follows : North: Adj. Road/ bungalow no. 85, South: Adj. Road, East: Adj. Road, West: Adj. Bungalow no. 104;

Date: 09-07-2021 | Place: Surat
Samarjeet Kumar, Authorized Officer, Bank of Baroda

Central Bank of India
1911 से आपके लिए "केन्द्रित"

BRANCH: BORSAD
APPENDIX-IV (See Rule 8(1))
POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the Authorized Officer of **Central bank of India**, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules 2002, issued demand notice dated **13.04.2021** calling upon the borrower **Mrs. Radhaben Tansukhbhai Rathi** to repay the amount mentioned in the notice being **Rs. 2,40,507.42 Plus Interest (Say Two Lakh Forty Thousand Five Hundred Seven and paise Forty Two only)** within 60 days from the date of receipt of the said notice.

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the Borrower/s and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property/ies described herein-below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act, read with the Rule 8 of the Security Interest (Enforcement) rules 2002 on this **9th day of July 2021**.

The Borrower/s in particular and the public in general are hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of Central Bank of India for an amount of **Rs. 2,40,507.42 Plus Interest (Say Two Lakh Forty Thousand Five Hundred Seven and paise Forty Two only)** and Further interest /Cost / Other Charges Etc. thereon (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect).

The borrower/s attention is invited to provisions of sub-section (8) of Section (13) of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY	
8-Shivshankar Society, R.S.No. 1744, paiki Plot No. 8, Property No. 8/8, Tarapur Road, Borsad, Tal: Borsad, Dist: Anand. Adm. Area 174.50 sq.mtr. (Belongs to Mrs. Radhaben Tansukhbhai Rathi).	
Bounded by: East: Plot No. 7, West: Plot No. 9, North: Road, South: R.S. 1775.	

Date: 15.07.2020 - Place: Anand
Authorised Officer, Central Bank Of India

Central Bank of India
1911 से आपके लिए "केन्द्रित"

BRANCH: BORSAD
APPENDIX-IV (See Rule 8(1))
POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the Authorized Officer of **Central bank of India**, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules 2002, issued demand notice dated **13.04.2021** calling upon the borrower **Mrs. Radhaben Tansukhbhai Rathi** to repay the amount mentioned in the notice being **Rs. 2,40,507.42 Plus Interest (Say Two Lakh Forty Thousand Five Hundred Seven and paise Forty Two only)** within 60 days from the date of receipt of the said notice.

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the Borrower/s and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property/ies described herein-below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act, read with the Rule 8 of the Security Interest (Enforcement) rules 2002 on this **9th day of July 2021**.

The Borrower/s in particular and the public in general are hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of Central Bank of India for an amount of **Rs. 3,90,158.82- Plus Interest (Three Lakh Ninety Thousand One Hundred and Fifty Eight and Paise Eighty Two)** and Further interest /Cost / Other Charges Etc. thereon (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect).

The borrower/s attention is invited to provisions of sub-section (8) of Section (13) of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY	
Non Agricultural land R.S. No. 1029/1 + 1029/2, 1034, TP No. 2, Final Plot No. 97 Paiki Plot No. B/6, House No. 10/B/6 Admeasuring Area 93.60 Sq.Mtr at Shivam Society Ta. Borsad Dist. Anand. Property owned by 1. Mr. Pareshkumar Vinubhai Patel and Mrs. Koklaben Vinubhai Patel. Bounded: East: Final Plot No. 96, West: Plot No. B/5, North: Final Plot No. 98, South: 6 Mtr Approach Society Way.	

Date: 15.07.2020 - Place: Anand
Authorised Officer, Central Bank Of India

Central Bank of India
1911 से आपके लिए "केन्द्रित"

BRANCH: BORSAD
APPENDIX-IV (See Rule 8(1))
POSSESSION NOTICE
(FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the Authorized Officer of **Central bank of India**, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules 2002, issued demand notice dated **13.04.2021** calling upon the borrower **Mr. Pareshkumar Vinubhai Patel & Mrs. Koklaben Vinubhai Patel** to repay the amount mentioned in the notice being **Rs. 3,90,158.82- Plus Interest (Three Lakh Ninety Thousand One Hundred and Fifty Eight and Paise Eighty Two)** within 60 days from the date of receipt of the said notice.

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the Borrower/s and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property/ies described herein-below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act, read with the Rule 8 of the Security Interest (Enforcement) rules 2002 on this **9th day of July 2021**.

The Borrower/s in particular and the public in general are hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of Central Bank of India for an amount of **Rs. 3,90,158.82- Plus Interest (Three Lakh Ninety Thousand One Hundred and Fifty Eight and Paise Eighty Two)** and Further interest /Cost / Other Charges Etc. thereon (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect).

The borrower/s attention is invited to provisions of sub-section (8) of Section (13) of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY	
Non Agricultural land R.S. No. 1029/1 + 1029/2, 1034, TP No. 2, Final Plot No. 97 Paiki Plot No. B/6, House No. 10/B/6 Admeasuring Area 93.60 Sq.Mtr at Shivam Society Ta. Borsad Dist. Anand. Property owned by 1. Mr. Pareshkumar Vinubhai Patel and Mrs. Koklaben Vinubhai Patel. Bounded: East: Final Plot No. 96, West: Plot No. B/5, North: Final Plot No. 98, South: 6 Mtr Approach Society Way.	

Date: 15.07.2020 - Place: Anand
Authorised Officer, Central Bank Of India

Reliance Home Finance Limited
Branch Office: Reliance Home Finance Ltd., 307, Proton Plus, B/H Star Bazar, L.P.Savani Road, Adajan Gaam, Surat-395009
Registered Office: - Reliance Home Finance Ltd., Ruby Tower, 11th floor, North West wing, Plot No.29, J.K Savant Marg, Dadar Mumbai 400 028

POSSESSION NOTICE (As per Rule 8(2) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas the undersigned being the Authorized Officer of **Reliance Home Finance Ltd.** under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 8 of the Security Interest (Enforcement) rules 2002, issued Demand Notices upon the Borrowers/Co-borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

The borrower/Co-borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates.

The Borrower/Co-borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Reliance Home Finance Ltd.**

The Borrower/Co-borrowers/Mortgagor(s) attention is invited to the provision of Section 13(8) of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

Name of Borrower / Co-borrower	Description of Property	Date of Demand Notices	Date of Possession	Amount mentioned in Possession Notice (Rs.)
1) Rampal Bhagwana Gurjar 2] Santoshdevi Rampal Gurjar	All the piece & parcel of Immovable property bearing Flat No. 501 on 5th floor, admeasuring 40.32 sq.mts. Built up area together with undivided proportionate share in undermeath land in Building No. B-1 in "Sanskriti Residency" situated on the land bearing R.S. No. 120 Block No. 312 adm. 3440 sq.mts. and R.S. No. 121 Block No. 313 adm. 1214 sq.mts. total adm. 4654 sq.mts. of Village Niyol Tal Palsana Dist Surat.	16th February, 2019	9th July, 2021	Rs. 1508265/-
1] Chhail Singh 2] Masarukanwar Chhail Singh	"All That Piece & Parcel Of Immovable Property Premises OF FLAT NO 201 Admeasuring 672 Sq MTRS Super Built Up Area 397 Sq Mtrs I.E 36.88 Sq Mtrs) Along With Undivided Share In Land Admeasuring 7.08 Sq Mtrs "SECOND FLOOR" SHREE KRISHNA AVENUE Developed Upon Land Situated In State Gujarat District Surat Sub District & Taluka Palsana Antroli Revenue Survey No 1 To 3.5,7,11 To 15 Block No 1 1 Paikce Admeasuring 27,817 Sq Mtrs Paikce Plot No 10 & 11 After Durst Block No 1 Paikce 3/10 & 1 Total Admeasuring I.E. 248.89 Sq Yards I.E 208.08 Mtrs.	11th May, 2019	9th July, 2021	Rs. 1189558/-
1) Sanjay Balubhai Makvana 2] Prabhaben Balubhai Makvana 3] Kanubhai Makvana	All the piece and parcel of properties FLAT NO.108,1ST FLR,VRUNDAVAN PALACE IN RAM NAGAR,B/S SHREE KRISHNA AVENUE, SURAT-KADODARA ROAD,ANTROLLI,PALSANA, Dist. Surat. And Dist. Ant. Tal. Palsana, Moje Antroli, Rev. Sur. No. 1 to 3, 5, 7, 11 to 15 Block No. 1 paikce admeasuring 27, 817 sq. mts. paikce Plot No. 12, 13, 14, 15 adm. 16fts x 70 fts. i.e. 4480-00 sq. fts. residential NA land paikce.	22nd December, 2018	9th July, 2021	Rs. 1798438/-
1) Himmatrao Santosh Bagal 2] Pratibha Himmat Bagal 3] Sambhaji Himmatrao Deshmukh	"All that Piece & Parcel of Immovable Property Premises .PLOT no 160 admeasuring 48.00 sq yard i.e 40.18 sq mtrs) (After KJP Block No 288/160 Admeasuring 40.18 sq mtrs) RAJMANDIR RESIDENCY " Developed upon Land situated in State : Gujarat District Surat Sub district & Taluka Palsana Moje: Tattihaiya Bearing Block No 288 (Block No 288, 289) admeasuring Hectare-Are 3-53-18 sq mtrs N A Land Paikce."	11th May, 2019	9th July, 2021	Rs. 1502890/-

Place: Surat
Date: 15th July, 2021
Sd/- (Authorised Officer)
Reliance Home Finance Ltd.

Bank of Baroda Uttarsanda Branch, Uttarsanda-387370
Tel 0268 258830 E Mail uttars@bankofbaroda.com

(See rule- 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES)

Whereas, The undersigned being the authorized officer of the **BANK OF BARODA** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **20.04.2021** calling upon the borrowers **Mr. KIRAN NATUBHAI PATEL (Borrower) & Mr. PATEL ANILBHAI (GUARATOR)** to repay the amount mentioned in the notice of Baroda home loan being **Rs. 33,55,435.48 (Rupees Thirty three lakhs fifty five thousand four hundred thirty five and forty eight paise only)** as on **20.04.2021** together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **symbolic possession** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this **12th day of July of year 2021**.

The borrowers/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda, Uttarsanda Branch** for an amount of **Rs. 33,55,435.48 (Rupees Thirty three lakhs fifty five thousand four hundred thirty five and forty eight paise only)** and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of Payment.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property owned by Mr. Kiran Natubhai Patel (Borrower)

Residential House in 'Shanti Park Society' which is constructed on NA sub plot no D-26, admeasuring 686.00 sqmtrs (682.00 plot area+24.00 sqmtrs road land) in block no 1684 paiki admeasuring 0-54-83 ARE of village Uttarsanda, Ta- Nadiad, Dist-Kheda Boundaries: **East** : Gulabvadi, **West:** Plot No. 25 Rameshbhai Vadhvani, **North:** 20' Road & Then Rajkalmi Society, **South:** Property of Madhusudan Mahantbhai (Block No:1686+1685)

Date: 12/07/2021
Place: Uttarsanda
Sd/- Chief Manager & Authorized Officer
Bank of Baroda

PNB Punjab National Bank
Branch Office: Patan Branch, Megh Plaza Complex, Ground Floor, Shop No. 1 to 7, Verai Chakla, Patan, Gujarat - 384265. Ph. 0276 - 6220095, e-mail: bo6702@pnbc.co.in

POSSESSION NOTICE
(Under Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002)

Whereas, The undersigned being the Authorized Officer of the Punjab National Bank, Patan Branch, Megh Plaza Complex, Ground Floor, Shop No. 1 to 7, Verai Chakla, Patan, Gujarat - 384265 Under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules-2002, issued a Demand notice dated **05.03.2019** calling upon the Borrowers **Mr. Baldevbhai Govabhai Rabari** to repay the amount mentioned in the notice being **Rs. 11,52,211/- (Rupees Eleven Lakh Fifty Two Thousand Two Hundred Eleven only)**, as on 11/17/2018 within 60 days from the date of receipt of the said notice with future interest and incidental charges w.e.f. 12/07/2018.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this **13th July 2021**.

The borrower/mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Punjab National Bank, Patan Branch, Megh Plaza Complex, Ground Floor, Shop No. 1 to 7, Verai Chakla, Patan, Gujarat - 384265 for an amount of Rs. 11,52,211/- (Rupees Eleven Lakh Fifty Two Thousand Two Hundred Eleven only)** as on 11/07/2018 plus interest and incidental expenses incurred by bank w.e.f. 12/07/2021.

The Borrower's/Guarantor's/Mortgagor's attention is invited to provisions of Sub-Section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Description of immovable property

Registered Mortgage of Residential House situated at Patan City, of Sudhrai & City Survey Boundary at Gungadi Pati, Gamthan tikka no. 11/2, S. No. 87, Paiki, Total area 33.74 Sq. Mtr. situated at Patan City, M.S. No. 1-8-29, Shah Vada, Nr. Ashokvadi of Patan. Owned by Rabari Baldevbhai Govabhai Bounded By: On the North by :House of Prajapat Shantilal, On the South by : House of Rabari Jetha Jora, On the East by : Road, On the West by : Wall Come of Modi.

Date : 13/07/2021
Place : Patan
Authorised Officer
Punjab National Bank

Canara Bank PORBANDAR II BRANCH

DEMAND NOTICE

To **MR. CHANDAN RAVJI VAGHE**

